



APAR

Tomorrow's solutions today

SEC/3101/2024

By E-Filing

January 31, 2024

National Stock Exchange of India Limited "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai - 400 051. Scrip Symbol : APARINDS Kind Attn.: Listing Department	BSE Limited Corporate Relations Department, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001. Scrip Code : 532259 Kind Attn. : Corporate Relationship Department
---	--

Subject : Publication of Extract of Un-audited Financial Results for the Third Quarter and Nine Months' period ended December 31, 2023 in Newspapers.

Ref. : Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir/ Madam,

We refer to our Letter No. SEC/3001/2024 dated January 30, 2024 vide which we have submitted the Un-audited Financial Results (Standalone and Consolidated) of the Company for the Third Quarter and Nine Months' period ended December 31, 2023 (2023-24), we are now submitting herewith copies of the Extract of Un-audited Financial Results of the Company for the Third Quarter and Nine Months' period ended December 31, 2023 (2023-24), on Consolidated basis, published in Business Standard, English language newspaper and Vadodara Samachar, Regional language newspaper, on January 31, 2024.

The above information is also available on the Company's website at www.apar.com.

Kindly take the above information on your record.

Thanking you,

**Yours Faithfully,
For APAR Industries Limited**

**(Sanjaya Kunder)
Company Secretary**

Encl.: As above

APAR Industries Limited

Corporate Office : **APAR House, Corporate Park, V. N. Purav Marg, Chembur, Mumbai - 400 071, India**
+91 22 2526 3400/6780 0400 corporate@apar.com www.apar.com

Regd. Office: **301/306, Panorama Complex, R. C. Dutt Road, Alkapuri, Vadodara - 390007, India**
+91 265 6178 700/6178 709 apar.baroda@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802

BEFORE THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL, AHMEDABAD BENCH
COMPANY PETITION NO. C.P.(CAA)/57(AHM)2023 IN COMPANY APPLICATION NO. C.A.(CAA)/47(AHM)2023
In the matter of the Companies Act, 2013 (Act No. 18 of 2013) and as amended from time to time and
Rules made thereunder as in force from time to time; And
In the matter of Section 230-232 and other relevant provisions of the Companies Act, 2013 and Rules made thereunder;
And
In the matter of Scheme of Arrangements in the nature of Demerger
Between
Mahalaxmi Rubtech Limited (MRT)
(CIN:- L25190GJ1991PLC016327)
("Demerged Company");
Mahalaxmi Fabric Mills Private Limited (Formerly known as "Sonnet Colours Pvt Ltd") (MFMLP)
(CIN:- U17100GJ1991PTC015345)
("First Resulting Company") And
Globale Tessile Private Limited (GTPPL)
(CIN:- U17299GJ2017PTC098506)
("Second Resulting Company") And
their respective Shareholders and Creditors

NOTICE OF THE HEARING OF THE PETITION

Pursuant to the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench (NCLT), Order dated 14th December, 2023 passed in C.P.(CAA)/57(AHM)2023 read with Order dated 17th January, 2024 passed in Comp. App. 2/NCLT(AHM)2024, Notice is hereby given that the Petition for sanctioning the Scheme of Arrangements between Mahalaxmi Rubtech Limited (MRT) (CIN:- L25190GJ1991PLC016327) ("Demerged Company"); Mahalaxmi Fabric Mills Private Limited (Formerly known as "Sonnet Colours Pvt Ltd") (MFMLP) (CIN:- U17100GJ1991PTC015345) ("First Resulting Company"); and Globale Tessile Private Limited (GTPPL) (CIN:- U17299GJ2017PTC098506) ("Second Resulting Company") and their respective Shareholders and Creditors ("Scheme"), was presented by the Petitioner Companies, on 08th December, 2023 and the same was admitted by the Hon'ble NCLT. The said Petition is fixed for hearing before the Hon'ble NCLT, on 15th February, 2024.

Any Person desirous of supporting or opposing the said Petition should send to the Petitioner Companies' Advocate namely Shri Jaimin Dave, in soft copy, at irdadvocates@gmail.com and/or in hard copy, to 201-202, Hir-Asha Arcade, Nr. Shalin Hospital, High Court Judicial Academy Road, Bn. High Court, Science City, Ahmedabad-380 060, Gujarat, notice of such intentions, in writing, signed by him/her or his/her Advocate, with his/her full name and address, so as to reach the Petitioner Companies' Advocate note later than two days before the date fixed for hearing of the said Petition. Where he/she seeks to oppose the Petition, the ground of opposition or a copy of his/her affidavit shall be furnished with such Notice.

A copy of the Petition will be furnished by the undersigned to any Person, on payment of prescribed charges.

Sd/-
SHRI JAIMIN DAVE
ADVOCATE FOR THE PETITIONER COMPANIES

DATE:- 30th JANUARY, 2024
PLACE:- AHMEDABAD

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN: L65110TN2014PLC097792
Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chepelt, Chennai- 600031.
Tel. +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) the loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice	Property Address
1	72591674	Loan Against Property	1. Dineshbhai Kalubhai Mujiya 2. Mujiya Manishaben Dineshbhai	23.12.2023	INR 2,74,288.28/-	All That Piece And Parcel Of Immovable Properties Being The Residential Plot Constructed On Residential Plot Bearing Dhrangadhra R.S.No.1501, Paiki Plot No.146 Land Admeasuring 85.00 Sq. Mts., Having Construction Of Plot Thereon Within The Limits Of Municipal Area, Situated At Place Known As Village Dhrangadhra, Tal. Dhrangadhra, Dist. Surendranaga, Gujarat-363310, And Bounded As: East : In This Side Plot No. 146/Aiki, West: In This Side Plot No. 147, North : In This Side S.No1501/paiki, South : In This Side 9.00 Mt. Road
2	41137899	Loan Against Property	1. Dipeshkumar Jagdishchandra Maheta 2. Padmaben Dipeshkumar Maheta	23.12.2023	INR 13,57,496.34/-	All That Piece And Parcel Of Immovable Properties Being The Residential House Bearing Halvad City Survey No. 584 Paiki, Originally N.A. Land Of Rev Survey No. 2237 Paiki Plot No. 152 Paiki Southern Part Admeasuring. 10.75 Sq. Mts. And Plot No.153 Paiki Northern Part Admeasuring 73.58 Sq. Mts. Total Land Admeasuring 84.33 Sq. Mts. Having Construction Of House Thereon Within The Limits Of Halvad Nagarpalika, Situated At Place Known As "Vasant Park", Dhrangadhra - Maliya Road At Halvad, Tal. Halvad, Dist. Surendranagar, Gujarat - 363330, And Bounded As: East : On That Direction The 7.50 Mts. Wide Road, West : On That Direction The Land Of Plot No. 143 & 144, North : On That Direction The Land Of Plot No. 152 Paiki, South : On That Direction The Land Of Plot No. 153 Paiki

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-
Authorized Officer
IDFC First Bank Limited

Date : 31.01.2024
Place : Gujarat

(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)

IDBI BANK IDBI BANK LIMITED
Forum Building, 2nd Floor, F P No 147 & 148, Between Canopus Shopping Mall and Citi Bank, Ghod Dod Road, Surat- Pin :395007
CIN: L65190MH2004G01148838

PUBLIC NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY THROUGH E-AUCTION UNDER SARFAESI ACT 2002 APPENDIX IV-A [SEE PROVISO TO RULE 8 (6) & 9 (1)]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & 9 (1) of the Security Interest (Enforcement) Rule, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged / charged to IDBI Bank Ltd., the Physical Possession of which has been taken by the Authorised Officer of IDBI Bank Ltd., Secured Creditor, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" on February 28, 2024 for recovery of Rs.25,94,284/- (Rupees Twenty-five lakhs ninety-four thousand two hundred and eighty-four only) with further interest from December 11, 2019 and incidental expenses, costs thereon, due to IDBI Bank Ltd. from Jayesh Madhavji Kaneriya and Chhayaben J Kaneriya. The reserve price will be Rs.29.99 lakhs and the earnest money deposit will be Rs.3.00 lakhs.

Description of Property: All that part and parcel of the immovable property situated at Flat no-A-304, Hari Krishna Residency, Nr. Manya Residency, Opp. Hari Krishna Exports Pvt Ltd., Off Vraj Chowk Road, Sarthana Jakat, Naka, Simada, Surat-395006 in the State of Gujarat having super-built up area of 1071 Sq.ft.

Reserve Price	EMD	Date of Inspection	Last Date of Submission of Bids along with EMD	Date & Time of E-auction	Bid/ Tender Increase Amount
Rs. 29.99 Lakh	Rs. 3.00 Lakh	26.02.2024 (11 am to 2 pm)	01.03.2024 11 am to 4 pm	04.03.2024 at 11 am to 2 pm	By Rs. 25,000/-

List of the terms & conditions appearing in Bid Document:

- The aforesaid property shall not be sold below the reserve price mentioned above.
- The sale shall take place on the expiry of fifteen days from the date of publication of this notice.
- The Earnest Money Deposit - (EMD) will not carry interest. AO may retain EMD of top three bidder's up to 3 months from the date of opening of the bids.
- The AO may permit inter-se bidding among the top three bidders.
- The successful bidder will be required to deposit 25% of the sale price (less the amount of EMD deposited) at the time of confirmation of sale. The balance amount of the sale price is to be paid within 15 days of the confirmation of the sale or such extended period as may be agreed to by the AO. In case of failure to deposit the balance amount within the prescribed period, the deposited amount shall be forfeited, including earnest money.
- AO reserves the right to accept or reject any or all bids without assigning any reason(s). In case all the bids are rejected, the AO reserves the right to sell the assets by any of the modes as prescribed in the SARFAESI Act.
- The Secured Assets mentioned in the Bid Document are based on the charges/mortgages created by the Borrower in favour of Secured Creditors, the details whereof are given in the bid document. Interested parties are requested to verify the details of the Secured Assets and inspect the records relating to mortgaged assets available with AO on request.
- Secured creditors do not take responsibility for any errors/omissions/discrepancy/ shortfall etc in the secured Assets or for procuring any permissions etc or for the dues of any authority established by law.
- The Secured Assets are being sold free from charges and encumbrances of Secured Creditors only.
- The successful bidder would be required to bear all the necessary expenses like stamp duty, registration, expenses, tax liabilities, if any etc for transfer of secured asset.
- The sale will attract provisions of TDS as applicable under Section 194 (1A) Income Tax Act, on culmination of sale depending on sale price.
- For e-Auction support, please contact : M/s e-Procurement Technologies Limited - Auction Tiger, Bidder Support: 9265562821 - 079 61200 594 / 598 / 568 / 587 / 538 and Shri Chintan Bhatt, M: 9978591888, Help Line E-mail ID: gujarat@auctiontiger.net, chintan.bhatt@auctiontiger.net, <https://idbi.auctiontiger.net>
- This publication is also "Thirty Days" notice required under Rule 8(6) of Security Interest (Enforcement) Rules, 2002 to borrower/guarantor/mortgagor to pay outstanding dues.

The Auction shall be subject to detailed terms and conditions as available in the Bid Documents. Bid document can be obtained from Shri Deepak K. Singh (M) 9320194547 email id- singh.deepak@idbi.co.in, Smt. Mary Sabu (M) 7045751125 email id- s.mary@idbi.co.in, Address: IDBI Bank Ltd. Regional Office, 4th Floor, Forum Building, FP No. 147 & 148, Between Canopus Shopping Mall and Citi Bank, GhodDod Road, Surat, Gujarat - 395007 and can also be downloaded from www.idbibank.in or <https://idbi.auctiontiger.net>

Date: 30.01.2024 - Place: Surat Sd/- Authorised Officer - IDBI BANK LTD.

Cholamandalam Investment and Finance Company Limited
Corporate Office : "CHOLA CREST" C 54 & 55, Super B-4, Thiru Vi Ka Industrial Estate, Gundy, Chennai - 600032, India.
DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002

Name of Borrower(s) & Address		Secured Assets	
A	B	C	D
Vijay Shamjibhai Balar (Applicant) Res:- 60-61 Saraswati Society, Nr. Shyam Dham Society, Puna Simada Road, Nana, Varachha, Surat-395006 Vijay Shamjibhai Balar (Applicant) Off:- Shop No-36 Nr. Sarthi Society, Raw House B/h Sarthana 200, Sarthana, Jakat Naka, Varachha, Surat - 395006 Ghanshyam Shamjibhai Balar (Co Applicant) Res:- 60-61 Saraswati Society, Nr. Shyam Dham Society, Puna Simada Road, Nana Varachha, Surat-395006 Ghanshyam Shamjibhai Balar (Co Applicant) Off:- Shop No-36 Nr. Sarthi Society, Raw House B/h Sarthana 200, Sarthana Jakat Naka, Varachha, Surat - 395006	All That Entire Flat No. 304 On The 3Rd Floor, Admeasuring 1175 Sq. Fts., Super Built-Up Area 834 Sq.Fts., Built-Up Area, Along With 35.8832 Sq. Mts., Undivided Share In The Land Of Rajhansh Tower Of Tower No. A, Situated At Revenue Survey No. 4, Block No. 4, Admeasuring 6602.50 Sq.Mts., Of Moje Village Motavarachha, City Of Surat, Own By Vijaybhai Shamjibhai Balar, Bounded By East: After Road Deduction Block No. Land Of 7 & 9, West: Village Floor Properties, North: Applicable Block No. 3 Of The Land, South: Block No. 2 Of The Land		
Date of Loan	Account Number	Loan Amount	Date of Demand Notice
10/11/2012	XOHERHE00000848692	Rs. 16,75,000.00	17/01/2024
Outstanding Amount	NPA Date		
Rs.20,08,827.18 as on 08/01/2024 together with further interest at contractual rate of interest,	06/01/2024		

The Under signed is the Authorised Officer of Cholamandalam Investment and Finance Company Limited hereinafter called the secured creditor, under Rule 2(a) of the security interest (Enforcement) Rules framed under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. In pursuant to Name of Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) & Address mentioned in column[A] Secured Assets in column [B] Date of Loan in column [C] Account Number in column [D] Loan Amount in column [E] Date of Demand Notice in column [F] Outstanding amount in column [G] NPA Date in column [H]. Towards the due repayment of loan, equitable mortgage by deposit of title deeds of the assets in column [G] was created by the borrowers.

On persistent default in repayment of the loan amount the loan accounts of the borrowers have been classified by the secured creditor as Non Performing Asset column [H] accordance with the directions and guidelines issued by the Reserve Bank of India. Consequently notice under Sec. 13(2) of the Act was also issued to each of the borrowers on the dated mentioned in column [F], which has been returned undelivered. I state the under section 13(13) of the Securitisation Act, you can redeem the secured asset by payment of the entire outstanding including all costs, charges and expenses before notification of sale. In view of the above, the above named borrowers are called upon to discharge in full their liabilities towards the Secured Creditor by making the payment of the entire outstanding indicated in Column [G] above including up to date interest, costs and charges within 60 days from the date of notice, failing which, the creditor shall be entitled to take possession of the Secured Asset and shall also take such other actions as is available to the Secured Creditor in law. In the absence of full discharge of dues even agree the transfer of secured assets the secured creditor reserves its right to proceed against the borrowers before a Sole Arbitrator, in terms of the Loan Agreement. In addition the above named borrowers shall not alienate by way of transfer, sale lease or otherwise or create third party interest or dealing with the Secured Asset in column [B] mentioned against the name of each borrower in any manner except with specific prior written permission of the secured creditor.

Date : 31.01.2024 Sd/- Authorised Officer, Cholamandalam Investment and Finance Company Limited

POSSESSION NOTICE (for immovable property)
(as per Appendix IV read with Rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002)

EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED
Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098

Whereas, That the Original Lenders have assigned the below financial assets to Edelweiss Asset Reconstruction Company Limited which is acting in its capacity as various trustees mentioned below (EARC). Pursuant to the assignment agreements, under Sec.5 of SARFAESI Act, 2002, EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests of Assignor with respect to the financial assets along with underlying security interests, guarantees, pledges have vested in EARC in respect of the financial assistance availed by the Borrowers and EARC exercises all its rights as a secured creditor.

The Authorized Officer of the EARC, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12) read with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned below calling upon the borrower(s) to repay the amounts mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned being the Authorised Officer of Edelweiss Asset Reconstruction Company Limited has taken Physical Possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on the date mentioned against each property.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for the amount mentioned below and interest thereon.

Name of Assignor	Name of Trust	Loan A/c Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
Edelweiss Housing Finance Ltd. (EHFL)	EARC TRUST SC-401	LANKSTHO 000063039	1) Shri Narshibhai Ranchhodhaji Jinjala 2) Smt. Muktaben N. Jinjala	Rs. 12,69,545.36/- (Rupees Twelve Lac Sixty Nine Thousand Five Hundred Forty Five paisa Thirty Six Only) as on 21.08.2019 & 21.08.2019	25-01-2024	Physical Possession
Religare Housing Development Finance Corporation Limited (RHFL)	EARC TRUST SC-421	XMHDAHR 00077543	1) Shri Girish Prajapati (Borrower) 2) Smt. Jyotiben Girishbhai Prajapati (Co-Borrower) 3) Shri Alpesh Laxmanbhai Chavda (Co-Borrower)	Rs. 20,25,382.04 (Rupees Twenty Lac Twenty Five Thousand Three Hundred Eighty Two paisa Four Only) as on 23.02.2023 & 23.02.2023	28-01-2024	Physical Possession
A.U. Small Finance Bank Ltd. (AUSFB)	EARC TRUST SC-379	900106010 1071430	1) Shri Manubhai Dhanabhai Parmar (Borrower) 2) Smt. Jashiben Manubhai Parmar (Co-Borrower) 3) Shri Parth Manubhai Parmar (Co-Borrower & Mortgagor) 4) Shri Umangbhai Manubhai Parmar (CoBorrower & Mortgagor)	Rs. 10,99,850.00 (Rupees Ten Lac Ninety Nine Thousand Eight Hundred Fifty Only) as on 31.10.2018 & 02.03.2019	29-01-2024	Physical Possession

Description of Secured Asset - Schedule Property- All the part and parcel of immovable property being Plot No. 178, Sai Darshan Residency, Near Reliance Petrol Pump, N.H. No. 8, Kapodara, Ankleshwar, Bhanu, Ankleshwar - 393001 & Bounded as: By North : Plot No. 193, By South : Society Road, By East: Plot No. 177, By West: Plot No. 179

Description of Secured Asset - Schedule Property- PROPERTY NO. 1: All the piece and parcel of the residential property bearing C.S. No. 2719, Dhumalia ni Dely, Opp. Gor ni Fall, Near Shrinath Parlar, Bavla Ahmedabad- 382260 and (admeasuring about 24.34007 Sq. Mtrs.) In "Dhumaliya ni Dely", situated at City Survey No. 2719, Sheet No. 48, Mouje: Bavla & Bounded as: By North : Vishnubhai House, By South : Road, By East: Del Road, By West: Lalithbhai House

PROPERTY NO. 2: All the piece and parcel of the property being Shop No. 10 C.S. No. 169 Paiki, GF Nagar Paika Property No. 1/67/5, Taluka Himatanagar, Dist. Sabarkantha, Gujarat admeasuring 13 Sq. Mtr. owned by Shri Parth Manubhai Parmar & Bounded as: By North : Road, By South : House of Modi, By East: Shop No. 10, By West: Shop No. 8

PROPERTY NO. 3: All the piece and parcel of the property being Shop No. 10 C.S. No. 169 Paiki, GF Nagar Paika Property No. 1/67/5, Taluka Himatanagar, Dist. Sabarkantha, Gujarat admeasuring 13 Sq. Mtr. owned by Shri Umang Manubhai Parmar & Bounded as: By North : Road, By South : House of Modi, By East: After leaving the parking Public Road, By West: Shop No. 9

Date : 31-01-2024
Place : Mumbai

Authorised Officer
Edelweiss Asset Reconstruction Company Limited

APAR APAR Industries Limited
Tomorrow's solutions today
(CIN : L91110GJ1989PLC012802)
Registered Office : 301, Panoramia Complex, R. C. Dutt Road, Vadodra - 390 007 (Gujarat), India.
Tel. No. : (0265) 6178700, 6178709, 2339906 E-mail : com.sec@apar.com URL : www.apar.com

EXTRACT OF UN-AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2023

₹ in crore

Particulars	Consolidated		
	Quarter ended 31st Dec., 2023 (Reviewed)	Nine Months ended 31st Dec., 2023 (Reviewed)	Quarter ended 31st Dec., 2022 (Reviewed)
Total Income from operations	4,013.16	11,711.08	3,938.92
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	284.30	784.22	229.81
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	284.30	784.22	229.81
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	217.57	588.88	169.90
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	213.67	593.68	242.43
Equity Share Capital (refer note 4)	40.17	40.17	38.27
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)			
Basic and Diluted (in ₹)	56.62	153.25	44.40

Notes :

- The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 30th January, 2024.
- Additional information on Standalone financial results is as follows : ₹ in crore

Particulars	Quarter ended 31st Dec., 2023 (Reviewed)	Nine Months ended 31st Dec., 2023 (Reviewed)	Quarter ended 31st Dec., 2022 (Reviewed)
Total Income from Operations	3,746.88	10,896.89	3,623.78
Profit before tax	270.74	777.10	214.02
Profit for the period	205.82	584.82	157.86
Total Comprehensive Income (after tax)	201.65	588.16	222.94

- The above is an extract of the detailed format of Statement of standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website www.apar.com.
- On November 30, 2023, the Share Issue Committee of board of directors of the Company has approved an allotment of 18,99,696 equity shares having face value of Rs.10 each at a premium of Rs. 5,254 per equity share aggregating to Rs.1,000 crores to eligible Qualified Institutional Buyers.

For APAR Industries Limited
Sd/-
Kushal N. Desai
Chairman & Managing Director
DIN : 00008084

Place : Mumbai
Date : 30th January, 2024

Markets,
Insight Out

Markets,
Monday to Saturday

To book your copy,
sms reachbs
to 57575 or
email order@bmail.in

Business Standard
Insight Out

